

## નાણાકિય વર્ષ 2018-19 માટેના આવકવેરના દર

### 60 વર્ષથી ઓછી વયની વ્યક્તિ માટે

કરપાત્ર આવક	દર
Rs. 2,50,000 સુધી	<i>Nil</i>
Rs. 2,50,000 થી Rs. 5,00,000	5 %
Rs. 5,00,000 થી Rs. 10,00,000	20%
Rs. 10,00,000 થી વધુ	30%

### 60 વર્ષથી 80 વર્ષ સુધીની વયની વ્યક્તિ માટે

કરપાત્ર આવક	દર
Rs. 3,00,000 સુધી	<i>Nil</i>
Rs. 3,00,000 થી Rs. 5,00,000	5 %
Rs. 5,00,000 થી Rs. 10,00,000	20%
Rs. 10,00,000 થી વધુ	30%

### 80 વર્ષથી વધુ વયની વ્યક્તિ માટે

કરપાત્ર આવક	દર
Rs. 5,00,000 સુધી	<i>Nil</i>
Rs. 5,00,000 થી Rs. 10,00,000	20%
Rs. 10,00,000 થી વધુ	30%

## રીબેટ

આવકવેરાના કાયદાની કલમ 87A હેઠળ રૂ. 3,50,000 સુધીની કરપાત્ર આવક ધરાવતી રહીશ વ્યક્તિના કેસમાં તેને ભરવાપાત્ર આવકવેરામાંથી 100% વેરો અથવા રૂ. 2,500/- બે માંથી જે રકમ ઓછી હોય તે આવકવેરા રીબેટ તરીકે મળવાપાત્ર છે.

## સ્ટાન્ડર્ડ ડીડક્શન

2018ના બજેટ પ્રમાણે દરેક પગારદાર તથા પેન્શનરોને રૂ. 40,000 સુધીનું સ્ટાન્ડર્ડ ડીડક્શન મળવાપાત્ર છે.

## સરચાર્જ

- 50 લાખથી 1 કરોડ સુધીની આવક પર ઇન્કમેટેક્સના 10%
- 1 કરોડથી વધુ આવક પર ઇન્કમેટેક્સના 15%

## હેલ્થ & એજ્યુકેશન સેસ:

**ઇન્કમેટેક્સના 4% (2018ના બજેટ પ્રમાણે)**

## કલમ 80EE હેઠળ મકાન લોનના વ્યાજની કપાત

- આ વિભાગ હેઠળની કપાત માત્ર વ્યક્તિગત કરદાતાઓ માટે જ ઉપલબ્ધ છે
- આ કપાત આવકવેરા અધિનિયમની કલમ 24 હેઠળ હોમ લોનના વ્યાજ પર રૂ. 2 લાખની મર્યાદામાં મળતી કપાત ઉપરાંત વધારાની રૂ. 50,000ની કપાત છે.
- દાવો કરવા માટે આ કપાત લોન તમારી પ્રથમ નિવાસી મકાન મિલકત ખરીદવા માટે નાણાકીય સંસ્થા પાસેથી લેવામાં આવી હોવી જોઈએ.

## શરતો:

- આ તમે ખરીદી કરેલ પ્રથમ મકાન છે
- આ મકાનની કિંમત રૂ. 50 લાખ કે તેથી ઓછી છે
- આ મકાન માટે લેવામાં આવતી લોન રૂ. 35 લાખ અથવા ઓછી છે
- નાણાકીય સંસ્થા અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા લોન મંજૂર કરવામાં આવી છે
- 01.04.2016 થી 31.03.2017 વચ્ચે લોન મંજૂર કરવામાં આવી છે
- લોનની મંજૂરીની તારીખે કોઈ અન્ય ધરની માલિકી તમારી પાસે નથી